

તાત્કાલિક પ્રકાશન માટે

## બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં કન્ફર્મ્ડ (પાક્કા) COVID-19 કેસ પર સીટી ઓફ બ્રેમ્પટનનું નિવેદન

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 24, 2020) – આજે, સીટી ઓફ બ્રેમ્પટનને માહિતગાર કરવામાં આવ્યું હતું કે તેની સેન્ડલવૂડ ફેસિલિટીના ટ્રાન્ઝિટ ઓપરેટરનું COVID-19 પરીક્ષણ હકારાત્મક (પોઝિટિવ) આવ્યું હતું.

સીટીને જાણ થઈ એટલે તરત જ, કર્મચારીઓને તાત્કાલિક પીલ પબ્લિક હેલ્થને પ્રવૃત્તમય કર્યું.

અસરગ્રસ્ત વ્યક્તિએ આજે સવારે 502 ઝુમ મેઈન રૂટ પર અને ગઈકાલે, જૂન 23 નાં રોજ નીચેના રૂટ્સ પર કામ કર્યું હતું:

- રૂટ 502 ઝુમ મેઈન
- રૂટ 511 ઝુમ સ્ટીલ્સ
- રૂટ 4 ચિંગકુસી

આ ઓપરેટર 14 દિવસ સુધી સેલ્ફ-આઈસોલેશનમાં (જાને અલગ એકલા થઈને) રહેશે. આ સમયે, સીટીની અગ્રતા આ વ્યક્તિ અને તેઓના કુટુંબીજનોને સહાયતા પૂરી પાડવાની, અને અમારા કર્મચારીઓ, ગ્રાહકો અને આપણાં સમુદાયનું આરોગ્ય અને સુરક્ષાને સંરક્ષણની મદદ ચાલુ રાખવાની છે.

ઉપર જણાવેલા દિવસોએ સમીક્ષા કરવામાં આવેલી બસોમાં પ્રવાસ કર્યો હોય તેવા લોકો જેઓને સારું લાગતું હોય, કોઈ લક્ષણો ના જણાતા હોય, તેઓએ પોતાની રોજીંદી દિનચર્યા ચાલુ રાખવી જોઈએ અને પબ્લિક હેલ્થને ફોન કૉલ ના કરવો જોઈએ. લક્ષણો દેખાય તેવા લોકોને પબ્લિક હેલ્થને કૉલ કરવાનું કહેવામાં આવે છે. જો તમને ઈમરજન્સી મેડિકલ સહાયતા જોઈતી હોય તો, કૃપા કરી 911 નંબર પર કૉલ કરો.

પીલ પબ્લિક હેલ્થ દર્શાવે છે કે સામાન્ય સમુદાયને હોય તેના કરતા કોઈ વધારાનું જોખમ પબ્લિક ટ્રાન્ઝિટ બસના ઉતારુઓને રહેતું નથી.

ગયા મહિને, સીટી ઓફ બ્રેમ્પટને તમામ કર્મચારીઓને પોતાના સ્થાનિક આરોગ્ય એકમ મારફતે COVID-19 ટેસ્ટીંગ કરાવવાનું કહ્યું છે. આ વિનંતી ઓન્ટેરિયો ગવર્નમેન્ટની વધારાની પરીક્ષણ ક્ષમતા પૂરું પાડવાના અને પરીક્ષણની વિનંતી કરનાર તમામ વ્યક્તિઓનું પરીક્ષણ કરાવવાના નિર્ણય પછી કરવામાં આવી.

આગામી અઠવાડિયાઓમાં, બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પોતાની સગવડોમાં સ્થળ-પર (ઓન-સાઈટ) ટેસ્ટીંગ પૂરું પાડશે અને બધાં કર્મચારીઓ માટે પ્રોએક્ટિવ (અગમચેતી દેખાડીને સક્રિય બનીને) ટેસ્ટીંગ માટે પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખશે.

આ શહેર ધીરે ધીરે ફરીથી ખુલે ત્યારે, તે COVID-19 નાં ફેલાવા સામે કર્મચારીઓ, ગ્રાહકો અને સમુદાયને સંરક્ષણ આપવામાં મદદ મેળવવા દરેક જરૂરી પગલું ભરી રહ્યું છે.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ માટે વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને દર 48 કલાકે ચેપરહિત કરવાનું છે. આ સમયે, બસોને દર 24 કલાકે સેનિટાઈઝ (ચેપરહિત) કરવામાં આવે છે. સગવડો અને ટર્મિનલ લંચરૂમ્સ, ટેબલ્સ, કાઉન્ટર્સ અને ડોર હેન્ડલ્સને દિવસમાં બે વખત સાફ અને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યાં છે.

પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે, સીટી ઓફ બ્રમ્પટન દરેક વ્યક્તિને નોન-મેડિકલ માસ્ક પહેરવા પ્રોત્સાહિત કરે છે, ખાસ કરીને એવા સ્થળોએ જ્યાં વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવું પડકારભર્યું હોઈ શકે. શક્ય હોય ત્યાં, આ શહેર ઉતારુઓને ટર્મિનલ્સ પર, અને બસ સ્ટોપ્સ પર, માસ્ક પહેર્યો હોય તો પણ, એકબીજાથી ઓછામાં ઓછું બે મીટર (છ ફૂટ) દૂર રહીને વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર સંબંધિત ઉપાયો જાળવવા વિનંતી કરે છે. ઉતારુઓને પ્રવાસ કરતી વખતે, પોતાના અંગત ડિસઇન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનેટાઈઝર કે વાઈપ્સ સાથે રાખવાનું, પોતાના હાથ વારંવાર ધોવાનું અને પોતાની કોણીમાં ખાંસી કરવાનું કે છીંકવાનું યાદ અપાવવામાં આવે છે.

ગુરુવાર, જુલાઈ 2 થી, બસમાં ભાડું ચૂકવણી અને બસમાં આગળના દરવાજાથી પ્રવેશ ફરીથી શરૂ કરવામાં આવશે. પીલ પબ્લિક હેલ્થ અને ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયોની પબ્લિક ટ્રાન્ઝિટમાં માસ્ક્સ પહેરવાની કડક ભલામણને અનુસરતા, COVID-19 નો ફેલાવો રોકવામાં મદદ મેળવવા બ્રમ્પટન ટ્રાન્ઝિટમાં ઉતારુઓ અને ઓપરેટરો માટે બસોમાં અને ટર્મિનલ્સ પર જુલાઈ 2 થી નોન-મેડિકલ માસ્ક્સ પહેરવા અનિવાર્ય બનશે.

માસ્ક્સ પહેરવા અનિવાર્ય છે ત્યારે, જુવાન બાળકો કે તેઓને માસ્ક પહેરતા રોકે તેવી અન્ય તબીબી સ્થિતિઓ ધરાવતા બાળકોએ માસ્ક પહેરવા જરૂરી રહેશે નહીં.

સીટી ઓફ બ્રમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રમ્પટન ઈમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાં પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરી રહ્યું છે. અદ્યતન માહિતી નિયમિત મેળવવા

વેબસાઈટ [www.brampton.ca/COVID19](http://www.brampton.ca/COVID19) અને [www.bramptontransit.com](http://www.bramptontransit.com) જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે

Twitter પર [@bramptontransit](https://twitter.com/bramptontransit) ને અનુસરો . કોઈ પ્રશ્નો સીધા બ્રમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

-30-

**મિડિયા સંપર્ક :**

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)